

ત્વરિત જાહેરાત માટે

સીટી આરંભે છે સપ્ટેમ્બર 1ના રોજ બુઝુર્ગો માટે \$15નો બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પાસ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (05 જુલાઈ 2019) – આજે બ્રેમ્પટન સીટી કાઉન્સિલ વતી મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) દ્વારા \$15 સિનિયર્સ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પાસની જાહેરાત કરવામાં આવી.

દેશનાં સૌથી ઝડપી વિકાસ પામતા શહેરને સેવા આપવાના ભાગ તરીકે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ બ્રેમ્પટન નિવાસી 65ની વય કે વધુનાં બુઝુર્ગો માટે ડિસ્કાઉન્ટ સાથેના \$15 માસિક પાસનો આરંભ કરી રહ્યા છે. ડિસ્કાઉન્ટ સાથેના માસિક પાસનું વેચાણ તમામ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ટર્મિનલો અને સવલતો ખાતે ઓગસ્ટ 6ના રોજથી શરૂ થશે અને બુઝુર્ગો પોતાના ડિસ્કાઉન્ટ સાથેના પાસનો ઉપયોગ સપ્ટેમ્બર 1થી કરી શકશે.

ઓગસ્ટ 6થી બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સીટી હોલ અને ગોર મેડોઝ કમ્યુનિટી સેન્ટર ખાતે હંગામી લોકેશનો ખોલશે જેથી બુઝુર્ગો તેમના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સિનિયર આઈડી કાર્ડ, PRESTO કાર્ડ મેળવી શકે અને તેમના સિનિયર્સ બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પાસ ખરીદી શકે.

માસિક પાસ બુઝુર્ગોને જે તે કેલેન્ડર મહિના દરમિયાન અમર્યાદિત પ્રવાસની છૂટ આપશે. ટ્રાન્ઝિટ પાસ મેળવવા માટે બ્રેમ્પટનનાં બુઝુર્ગો પાસે પ્રમાણભૂત બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સિનિયર આઈડેન્ટિફિકેશન કાર્ડ અને PRESTO કાર્ડ અવશ્ય હોવા જોઈએ.

બ્રેમ્પટનનાં બુઝુર્ગો માટે \$1ની રોકડ ટિકિટ પણ PRESTO પર સપ્ટેમ્બર 1થી ઉપલબ્ધ થશે. સામાન્ય સિનિયર સાપ્તાહિક અને માસિક પાસ હવે પછી ઉપલબ્ધ થશે નહીં.

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પોસાય તેવો પ્રવાસ આપવા પ્રતિબદ્ધ છે. બ્રેમ્પટન 2040 વિઝન માટે ટર્મ ઓફ કાઉન્સિલ અગ્રિમતાઓના સમર્થનમામ સ્ટાફ કાઉન્સિલને 2020 અંદાજપત્ર પ્રક્રિયા દરમિયાન અહેવાલ રજૂ કરશે જેમાં બ્રેમ્પટનનાં બુઝુર્ગો માટે નિ:શુલ્ક ટિકિટદરો લાગુ કરવાના વિકલ્પોનો સમાવેશ કરવામાં આવશે.

સંપૂર્ણ વિગતો માટે [અહીં](#) ક્લિક કરો.

અવતરણો

"આપણી બ્રેમ્પટન 2040 વિઝન તરફની કુચ આગળ વધારતા અને એક હરિત શહેરનું નિર્માણ કરતી વખતે આપણે માત્ર કાર્યક્ષમ ટ્રાન્ઝિટ સેવા જ નહીં પરંતુ ડ્રાઈવિંગના એક વિશ્વાસપાત્ર વિકલ્પ આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય 2020માં બુઝુર્ગો માટે નિ:શુલ્ક ટ્રાન્ઝિટ લાગુ કરવાનું છે. આપણા બુઝુર્ગોએ આપણા સમાજનું નિર્માણ કર્યું છે અને તેઓને ટ્રાન્ઝિટ પાસમાં છૂટછાટો મળે તે ઉચિત જ છે."

- મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown)

"બ્રેમ્પટન ટ્રાન્ઝિટ અવિરતપણે એકંદરે સેવા ગુણવત્તા અને ગ્રાહક અનુભવને વધુ સારો બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે. બ્રેમ્પટનનાં બુઝુર્ગો માટે આ નવો પાસ તો અમારા 2019ના ગ્રાહક અખત્યારનામામાં રહેલ અનેક બાબતો પૈકી એક છે જે હાંસલ કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમે આપણા બુઝુર્ગો નિવાસીઓને ટ્રાન્ઝિટમાં સફર કરવા અને અમારી બસોની સુવિધાનો અનુભવ લેવા આહવાન કરીએ છીએ."

- એલેક્સ મિલોજેવિક, જનરલ મેનેજર, ટ્રાન્ઝિટ

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલે લક્ષ્ય બનાવ્યું હતું કે 2050 સુધીમાં શહેર દ્વારા ઉત્પન્ન થયેલ ગ્રીનહાઉસ ગેસ એમિશનો 80% જેટલા ઘટાડવા. આપણે જ્યારે પર્યાવરણ માટે મિત્રતાભરી નીતિઓ અને ટેકનોલોજીઓનું આયોજન અને શરૂઆત કરી રહ્યા હોય ત્યારે આ તબક્કે તેનો શુભારંભ કરવો યોગ્ય જ છે - એટલેકે ટ્રાન્ઝિટનો વધુ ઉપયોગ અને કારના ઉપયોગનું અવલંબન ઘટાડવું. નવા \$15 માસિક પાસથી મારે આપણા બુઝુર્ગોને ભાર નીકળી જીવન માણવા માટે પ્રોત્સાહિત કરવા છે. આ પુનઃવિચાર કરવાની એક તક છે કે આપ કેવી રીતે શહેરમાં ફરી શકો અને લોકો સાથે જોડાઈ શકો, સ્થળો અને પ્રસંગો માટે સફર કરી શકો."

- કાઉન્સિલર રોવેના સાન્તોસ, પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca